

Seat No. : \_\_\_\_\_

**JJ-117**

June-2022

**B.A., Sem.-II**

**EC-1-112 : Computer Application**

**(Introduction to Networking & Web Page Design Using HTML)**

**Time : 2 Hours]**

**[Max. Marks : 25**

- સૂચના : (1) વિભાગ- Iમાં દશવિલ તમામ પ્રશ્નોના ગુણ સમાન છે.  
(2) વિભાગ- Iમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.  
(3) પ્રશ્ન નંબર 9 કે જે વિભાગ - IIમાં છે તે ફરજિયાત છે.

**વિભાગ - I**

1. નેટવર્કિંગ એટલે શું ? તે જણાવી નેટવર્કિંગના ફાયદાઓ જણાવો અને નેટવર્કિંગના પ્રકારો વિશે વિગતવાર સમજાવો.
2. ટોપોલોજી એટલે શું ? નેટવર્કની જુદી-જુદી ટોપોલોજીની માહિતી આપો.
3. નોવેલ નેટવેરમાં કુલ કેટલી સગવડો છે ? તે જણાવી ગમે તે ચાર(4) વિગતવાર સમજાવો.
4. નીચેના વિશે વિગતવાર સમજાવો :
  - (1) સર્ચ એન્જીન (Search Engine)
  - (2) સ્વીચ (Switch)
  - (3) મોડેમ (Modem)
5. HTML એટલે શું ? HTML ટેગ લખવાના સામાન્ય નિયમો સમજાવી, Center, Left, Right ટેગ ઉદાહરણ સાથે સમજાવો.
6. HTMLમાં સ્પેશિયલ ઈફેક્ટ ટેગ કયા-કયા છે ? તે જણાવી ગમે તે ચાર (4) વિગતવાર, ઉદાહરણ સાથે સમજાવો.
7. નીચેના HTML ટેગ ઉદાહરણ સહિત સમજાવો :
  - (1) List Tag
  - (2) Anchor(A) Tag

8. નીચેના HTML ટેગ ઉદાહરણ સહિત સમજાવો :

- (1) BR
- (2) Head
- (3) HTML
- (4) SUB
- (5) SUP
- (6) BODY

### વિભાગ - II

9. નીચેના પ્રશ્નોના જવાબ આપો : (ગમે તે ચાર (4))

4

- (1) IEEEનું પૂરું નામ \_\_\_\_\_ છે.
  - (2) MANનું પૂરું નામ \_\_\_\_\_ છે.
  - (3) CSMA/CDનું પૂરું નામ \_\_\_\_\_ છે.
  - (4) SMTPનું પૂરું નામ \_\_\_\_\_ છે.
  - (5) FTPનું પૂરું નામ \_\_\_\_\_ છે.
  - (6) HTTPનું પૂરું નામ \_\_\_\_\_ છે.
  - (7) HTML કાર્બલ ટાઈપ કરવા માટે ટેક્સ્ટ એડીટર તરીકે કયું સોફ્ટવેયર વપરાય છે ?
  - (8) HTMLમાં આડી લીટી દોરવા કયો ટેગ વપરાય છે ?
-

Seat No. : \_\_\_\_\_

**JJ-117**

June-2022

**B.A., Sem.-II**

**EC-1-112 : Computer Application**

**(Introduction to Networking & Web Page Design Using HTML)**

**Time : 2 Hours]**

**[Max. Marks : 25**

- Instructions :**
- (1) All questions carry equal marks in Section – I.
  - (2) You have to attend any 3 questions from Section – I.
  - (3) Question Number 9 of Section – II is compulsory.

**Section – I**

1. What is Networking ? Explain briefly benefits of networking and discuss the types of networking.
2. What is Topology ? Explain Various Topologies of Network.
3. How many facilities available in novel Netware ? Explain any Four (4) of them.
4. Explain following in brief :
  - (1) Search Engine
  - (2) Switch
  - (3) Modem
5. What is HTML ? State the common rules to write HTML tag and explain Center, Left, Right TAG in HTML with Example.
6. State the special effect tags available in HTML and explain any four (4) of them with examples.
7. Explain HTML Tag with example :
  - (1) List Tag
  - (2) Anchor(A) Tag

8. Explain HTML Tag with example :

- (1) BR
- (2) Head
- (3) HTML
- (4) SUB
- (5) SUP
- (6) BODY

### Section – II

9. Answer the following questions : (Any **four (4)**)

**4**

- (1) Full form of IEEE is \_\_\_\_\_.
  - (2) Full form of MAN is \_\_\_\_\_.
  - (3) Full form of CSMA/CD is \_\_\_\_\_.
  - (4) Full form of SMTP is \_\_\_\_\_.
  - (5) Full form of FTP is \_\_\_\_\_.
  - (6) Full form of HTTP is \_\_\_\_\_.
  - (7) Which application is used as text editor to type HTML file ?
  - (8) Which tag is used to draw Horizontal Rule ?
-